

**કેમ્પ અને કોલેટર પોસ્ટ કરવા વચ્ચેનો સમયગાળો અપૂરતો હોવાથી વેબસાઈટ પર આપેલ શ્રેયાનતાયાદી અને સેમ્પલ કોલેટર મુજબ તૈયારી કરીને આવવું.**

પ્રતિ

યાદીમાં સમાવિષ્ટ શિક્ષકશ્રી

મુ.- ગામનું નામ

વિષય -ગણિત-વિજ્ઞાન/ભાષા/સામાજિક વિજ્ઞાન

સંબંધિત પ્રાથમિક શાળા

અરજીનો પ્રકાર દર્શાવ્યા મુજબ

તાલુકો સંબંધિત જિલ્લો- સંબંધિત

વિષય- એકતરફી જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેવા બાબત

ઉપરોક્ત વિષય અનુસંધાનમાં જાણાવવાનું કે જિલ્લા ફેર બદલીની તમારી અરજી અન્વયે આ જિલ્લાના શ્રેયાનતા ક્રમાંક અનુસાર આ જિલ્લામાં સમાવવાના થતા હોઈ સ્થળ પસંદગી કેમ્પમાં **તા.-14/02/2019ને ગુરુવારના રોજ (સમયપત્ર મુજબ)**

**પી.આર.ટ્રેનિંગ કોલેજ, રાયખડચાર રસ્તા, લાલદરવાજા પાસે અમદાવાદ-૧** ખાતે નીચે મુજબના પ્રમાણિત આધાર પુરાવા સાથે અચૂક હાજર રહેવા જાણાવવામાં આવે છે.

1. આપની અસલ સેવાપોથી ઉપરથી જન્મ તારીખ, ખાતામાં દાખલતારીખ તેમજ વતનના પુરાવાનો તેમજ લાયકાત અંગેનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો ફરજિયાત લાવવાનો રહેશે.
2. છેલ્લા ત્રણ વર્ષના ખાનગી અહેવાલના રિમાર્ક્સ તેમજ અગાઉ જિલ્લાફેર બદલીનો લાભ લીધેલ નથી તે અંગેનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું પ્રમાણપત્ર ફરજિયાત લાવવાનું રહેશે.
3. આપની પાસે ત્યાંના જિલ્લાનું સરકારી લેણું બાકી નથી તે અંગેનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું પ્રમાણપત્ર ફરજિયાત લાવવાનું રહેશે.
4. તમારી સામે કોઈ ખાતાકીય તપાસ ચાલુ કે સૂચિત નથી કે હાલ ફરજમોકૂફી હેઠળ નથી તે અંગેનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું પ્રમાણપત્ર ફરજિયાત લાવવાનું રહેશે.
5. વિધવા હોવા અંગેનું મામલતદારશ્રીનું અદ્યતન પ્રમાણપત્ર કે જેમાં પુનઃલગ્ન કર્યા નથી તેવા ઉલ્લેખવાળુ રજૂ કરવાનું રહેશે. તેમજ વિધવા હોવા બાબત રૂ.૫૦/-ના સ્ટેમ્પ-પેપર ઉપર સોગંદનામું તથા પતિના મૃત્યુનો દાખલો રજૂ કરવાનો રહેશે.
6. વિધવાના કિસ્સામાં પિયર અથવા સાસરીનો જિલ્લો હશે તો જ માન્ય ગણાશે તે માટે જરૂરી આધાર પુરાવા સાથે લાવવાના રહેશે.
7. દિવ્યાંગ(અપંગ) ઉમેદવારે દિવ્યાંગ હોવા અંગેનું સક્ષમ સિવિલસર્જનનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે.
8. વિધવા, દિવ્યાંગ(અપંગ), વાલ્મિકી ઉમેદવારે અગાઉ ભરતી માં લાભ લીધેલ નથી તે અંગેનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું પ્રમાણપત્ર ફરજિયાત લાવવાનું રહેશે.
9. કેમ્પમાં હાજર નહીં રહો તેવા સંજોગોમાં નામ.સરકારશ્રીના તા.-૨૩/૦૫/૨૦૧૨ના ઠરાવની સૂચના મુજબ તેમજ જરૂરી આધાર પુરાવા રજૂ ના કરવાને કારણે જિ.પ્રા.શિ.અધિકારી અમદાવાદ જે નિર્ણય કરશે તે ઉમેદવાર ને બંધનકર્તા રહેશે.
10. પ્રાથમિક શિક્ષક દંપતી /અન્ય દંપતીના કિસ્સામાં અત્રેના જિલ્લામાં પતિ/પત્નિ જે શાળા/ખાતામાં ફરજ બજાવતા હોય તે શાળાના આચાર્યનો /તા.પ્રા.શિ./ખાતાના વડાનું તા.-૧૮/૦૨/૨૦૧૪ના અદ્યતન નમુના મુજબ રજૂ કરવાનો રહેશે.
11. પ્રાથમિક શિક્ષક દંપતિનો લાભ માટે લગ્ન નોંધણી અંગેના રજીસ્ટ્રારશ્રીના નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
12. આ સાથે હાલના જિલ્લામાં તમે બદલી અંગેના તેમજ ભરતી અંગેના તમામ આદેશોની પ્રમાણિત નકલ લાવવાની રહેશે.
13. બદલી કેમ્પમાં અત્રેના જિલ્લાની જે પ્રાથમિક શાળામાં ખાલી જગ્યા હોય તેની યાદી મૂકવામાં આવશે તે પૈકીની શાળા નિયમ અનુસાર પસંદ કરવાની રહેશે.
14. બદલી કેમ્પમાં તમારી માંગણીથી આવવાનું હોઈ સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવાનું છે.
15. તમે રજૂ કરેલ પ્રમાણપત્રો ખોટા માલૂમ પડશે તો નોકરીમાં ભરતરફ થવાને પાત્ર ઠરશે.
16. વિકલ્પ લીધેલ હોય તેવા કિસ્સામાં તેમજ તમામ કિસ્સામાં મેળવેલ લાયકાત સાચી હોવાં બાબતે તેમજ નોકરી ચાલુ હોયતો રેગ્યુલર કોલેજમાં અભ્યાસ કરેલ નથી તેવી ઉમેદવારે સ્થળ પર બાંહેધરી રજૂ કરવાની રહેશે.
17. આ તમામ બાબતે કોઈ પણ પ્રકારનું દબાણ પંચાયત સેવા શિસ્ત અને અપિલ નિયમ-૨૦૦૨ અંતર્ગત શિક્ષાને પાત્ર બનશે.

<b>ખાસ નોંધ-</b>	આ બદલી કેમ્પ માત્ર ધોરણ દર્શીટ ઉચ્ચ પ્રાથમિકમાં સીધી ભરતી કે વિકલ્પ લઈ ફરજ બજાવતા શિક્ષકો પુરતો હોઈ જેની નોંધ લેશે. પ્રતિભાયાદીના કોલેટરવાળા ઉમેદવારોએ બદલી કેમ્પના દિવસે હાજર રહી હાજરીપત્રમાં સહી કરવાની રહેશે. જો હાજર નહીં રહો તો તેવા સંજોગોમાં આપ લક્ક જતો કરવા માગો છો એમ માની આપનું નામ પ્રતિભાયાદીમાંથી આપોઆપ રદ થશે જેની ખાસ નોંધ લેવી.
------------------	---

(સહી)

((ડૉ.એમ.એન.પટેલ))

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ

અમદાવાદ

**નકલ રવાના:-**

- ૧ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિ.પં.શિ.સમિતિ, સંબંધિત સંબંધિત શિક્ષકને જાણ કરવા સારૂ.જો સદર શિક્ષક નિવૃત્ત,મૃત્યુ,અરતરફ,રાજીનામું આપી છૂટા થયા હોય કે ફરજમોકૂફી હેઠળ કે અન્ય જિલ્લામાં બદલી થઈ હોય તો ઉલટ ટપાલે જાણ કરશો.
- ૨ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો તા. સંબંધિત જી. સંબંધિત સંબંધિત શિક્ષકને જરૂરી માહિતી આપવા તેમજ કેમ્પમાં હાજર રહેવા માટે જાણ કરવા સારૂ.
- ૩ આચાર્યશ્રી સંબંધિત પ્રા.શાળા તા.- સંબંધિત જિલ્લો સંબંધિત તરફ જાણ તેમજ અમલ સારૂ.